

એનએ.એસ.આર./૪૦૭/૨૦૧૬-૧૭
 નં.જમીન-ડી/કલમ-૬૫/વશી/૪૮૬૬ થી ૪૮૭૪/૧૬
 બીનપેતી શાખા, કલેક્ટર કચેરી, વડોદરા.
 તારીખ : ૨૦ / ૦૮ / ૨૦૧૬

વંચાણમાં લીધા :-

- (૧) અરજદારશ્રી ભરત કૃષ્ણકાંત ખોડે વિગેરે રહે. જ, સનત પાર્ક, ન્યુ સમા રોડ, વડોદરાની તા.૨૩/૦૩/૧૨ ની અરજી તથા તા.૨૦/૦૬/૧૬ ની પુનઃ વિચારણા અરજી
- (૨) મામલતદારશ્રી, વડોદરા શહેર (દક્ષિણ) ના (૧) પત્ર નં.જમીન/ વશી/૧૫૩૫/૧૨ તા.૦૫/૦૫/૧૨ (૨) પત્ર નં.જમીન/ વશી/૨૪૪૧/૧૬ તા.૨૩/૦૨/૧૬ થી રજુ થયેલ દરખાસ્ત/ અભિપ્રાય
- (૩) નાયબ કલેક્ટરશ્રી, જમીન સુધારણા, વડોદરાના પત્ર નં. ટેનન્સી/ એનએ/ વશી / ૩૬૩/ ૧૬ તા.૦૫/૦૨/૧૬ તથા પત્ર નં.ટેનન્સી/એનએ/વશી/૧૦૫૫/૧૬ તા.૧૦/૦૬/૧૬ થી રજુ થયેલ અભિપ્રાય.
- (૪) નગર નિયંત્રકશ્રી, વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ, વડોદરાના પત્ર નં.યુટીએ/ પ્લાન-૩/ અ/૮૩/૧૬ તા.૨૦/૦૨/૧૬
- (૫) જમીન સંપાદન અધિકારીશ્રીઓ (૧) નાયબ કલેક્ટરશ્રી વડોદરા (શહેર) ના પત્ર નં.જમીન/ વશી/૮૮૭/૧૬ તા.૦૩/૦૩/૧૬ (૨) નાયબ કલેક્ટર અને ખાસ જમીન સંપાદન અધિકારીશ્રી એકમ-૧, વડોદરાના પત્ર નં.જસ/ વળતર/ વશી/૧૮૨/૨૦૧૬ તા.૧૮/૦૨/૨૦૧૬ (૩) ખાસ જમીન સંપાદન અધિકારીશ્રી, નર્મદા યોજના વડોદરાના પત્ર નં.જસ/ નં.ધો./ વડોદરા/ વશી/ એસઆર/૨૧૪/૧૬ તા.૨૫/૦૨/૧૬ થી રજુ થયેલ અભિપ્રાયો.
- (૬) સરકારશ્રીના મહેસુલ વિભાગની ઠરાવ ક્રમાંક : બપપ/૧૦૦૬/૪૨૫/ક, તા.૦૧/૦૭/૨૦૦૮
- (૭) તા.૦૨/૦૮/૧૬ ની કાર્યાલય નોંધ ઉપર આપાયેલ આદેશ

કુ સ મ :-

અરજદારશ્રી ભરત કૃષ્ણકાંત ખોડે વિગેરે રહે. જ, સનત પાર્ક, ન્યુ સમા રોડ, તા.જી.વડોદરાની મોજે માંજલપુર તા.જી.વડોદરાના સ.નં.૩૩૬/૨, ટી.પી.નં.૧૮, કા.પ્લોટ નં.૪૩૮ ની ૧૪૩૪ ચો.મી જમીનની રહેણાંકના હેતુસર બીનપેતીનો ઉપયોગ કરવા વંચાણ-૧ માં દર્શાવેલ અરજીથી માંગણી કરેલ છે.

મામલતદારશ્રી, વડોદરા શહેર (દક્ષિણ) વંચાણ-૨ ના પત્રથી અહેવાલ ચેકલીસ્ટ રજુ કરેલ છે. તેમજ સવાલવાળી જમીનના કબજેદાર અરજદારશ્રી તથા જમીનનું ટાઈટલ કલીયર હોવા બદલ પ્રમાણપત્ર આપેલ છે. તેમજ સવાલવાળી જમીન સ્થળે મુલ્કી હોઈ બીનપેતીની પરવાનગી આપવા માટે હકારાત્મક અભિપ્રાય રજુ થયેલ છે.

નાયબ કલેક્ટરશ્રી, જમીન સુધારણા, વડોદરાએ વંચાણ-૩ થી સવાલવાળી જમીનના અરજદાર ખેડુત ખાતેદાર છે. બીનપેતી પરવાનગી આપવા અંગે ગણોત કાયદા અન્વયે હરકત સરખું ન હોવાનો હકારાત્મક અભિપ્રાય આપેલ છે.

વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ, વડોદરાએ વંચાણ-૪ થી જી.ડી.સી.આરના ઝોનિંગ રેગ્યુલેશન મુજબ સવાલવાળી જમીનને અરજદારશ્રીની માંગણી મુજબના હેતુ માટે બિનપેતીની પરવાનગી આપવામાં આવે તો ઝોનની દૃષ્ટિએ વાંધા સરખું નથી, તેમ અભિપ્રાય આપેલ છે.

સંપાદન અધિકારીશ્રીઓના વંચાણ-૫ ના પત્રોથી સવાલવાળી જમીન અંગે તેઓની કચેરીમાં સંપાદનની કોઈ કાર્યવાહી ચાલુમાં નથી. તેમ જણાવેલ છે.

ઉપરોક્ત હકીકતે રજુ થયેલ અહેવાલ-અભિપ્રાય નજરે વંચાણમાં દર્શાવેલ સરકારશ્રીના ઠરાવની જોગવાઈઓ તથા ઉક્ત રજુ થયેલ અભિપ્રાયો ધ્યાને લઈ, અરજદારશ્રીની માંગણી મુજબ સવાલવાળી જમીનને બીનપેતીમાં ફેરવવા અંગેની માંગણી ગ્રાહ્ય રાખતાં, અરજદારશ્રી ને સંદર્ભે જમીનના રૂપાંતરકરની રકમ, બીનપેતીની માપણી ફી તથા અન્ય ઉપકરો સરકારશ્રીમાં જમા કરાવવા જણાવતાં, અરજદારશ્રીએ રૂપાંતરકરની રકમ રૂ. ૧૪,૩૪૦/- (અંકે રૂપિયા ચૌદ હજાર ત્રણસો ચાલીસ પુરા) તા.૦૨/૦૮/૧૬ તેમજ બીનપેતી માપણી ફી રૂ. ૨૦,૦૦૦/- (અંકે રૂપિયા વીસ હજાર સાતસો પુરા) તા.૦૩/૦૮/૧૬ ના રોજ તેમજ વિશેષધારો + લોકલ ફંડ રૂ. ૧,૬૨૦/- (અંકે રૂપિયા એક હજાર છસો વીસ પુરા) તા.૦૨/૦૮/૧૬ ના રોજ શિલ્પ ઉપકર રૂ. ૨૦૦/- (અંકે રૂપિયા બસો સીતર પુરા) તા.૦૩/૦૮/૧૬ ના રોજ તલાટીશ્રી, માંજલપુર દ્વારા સરકારશ્રીમાં વસુલ લેવાયેલ છે, તેની અસલ ચલન/ પહોચો રજુ કરેલ છે.

સભ્ય ઉપરોક્ત હકીકતે મુંબઈ જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫ અન્વયે સવાલવાળી મોજે માંજલપુર તા.જી. વડોદરાના સ.નં.૩૩૬૨, ટી.પી.નં.૧૯, કા.પ્લોટ નં.૪૩૮ ની ૧૪૩૪ ચો.મી જમીનની રહેણાંક હેતુ માટે બીનાખેતીનો ઉપયોગ કરવા, નીચેની શરતોને આધીન પરવાનગી આપવામાં આવે છે.

શ ર તો :-

- (૧) ઈસ્ટ્રીક્ટ ઈન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ્સ ધ્વારા ઈસ્યુ કરાયેલ માપણી શીટ કે જેના ઉપર મૂળ ટિપ્પણની હદ પણ દર્શાવેલ હોવી જોઈએ. રજૂ કરાયેલ પ્લાન તથા લે-આઉટ પ્લાન સહમત કર્યા પછી મંજૂર કરાવેલ હોવો જોઈશે.
- (૨) બાંધકામ શરૂ કરતા પહેલા બાંધકામના નકશા સહમત અધિકારી પાસે મંજૂર કરાવવાના રહેશે, પરંતુ અરજદાર બિનાખેતી પરવાનગી મેળવ્યા વગર આવા બાંધકામની રજા ચીટી મેળવી શકશે નહીં.
- (૩) શહેરી વિસ્તાર જ્યાં ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થઈ ગઈ છે ત્યાં જી.ડી.સી. આર. અને ઝોનીંગના નિયમો અનુસાર બાંધકામ કરવાનું રહેશે.
- (૪) મંજૂર થયેલ નકશા મુજબ આરોગ્ય અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગંદા પાણીના નિકાલની જોગવાઈ કરવાની રહેશે.
- (૫) અરજદારે રીબન ડેવલપમેન્ટ ટ્રસ્ટ નીચે જે તે રસ્તાનો પ્રકાર ધ્યાને લઈ રસ્તાના મધ્યબિંદુથી બાંધકામ વચ્ચે અંતર જાળવવાનું રહેશે અન્યથા અરજદારની જવાબદારી થશે.
- (૬) ઔદ્યોગિક હેતુ માટે મંજૂરી માંગેલ હોય તો બાંધકામ કરતાં પહેલા જિલ્લા ઉદ્યોગ અધિકારી/શ્રીની જરૂરી મંજૂરી મેળવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવાની રહેશે.
- (૭) સવાલવાળી જમીન જો જેલથી નજીક હોય તો ૧૮૪ મીટરનું અંતર હોવી બાંધકામ કરવાનું રહેશે.
- (૮) સવાલવાળી જમીન જો રેલ્વે હદની નજીક હોય તો રેલ્વેની હદથી ૩૦ મીટર જગ્યા હોવી બાંધકામ કરવાનું રહેશે.
- (૯) સવાલવાળી જમીન ઉપરથી અથવા બાજુમાંથી વિજળી ગ્રીડના તાર/ હાઈટેન્શન પાવર અગર થાંભલા આવેલ હોય ત્યારે તે અન્વયે લાગુ પડતા નિયમોનું પાલન કરવાનું અને તે મુજબ બાંધકામ કરવાનું રહેશે.
- બિનાખેતી માંગવામાં આવી હોય તેવી જમીન જો એરોડ્રામ આસપાસના ૨૦ કી.મી.ની વિજયામાં આવતી હોય ત્યારે બાંધકામની ઉંચાઈ તથા એરોડ્રામની દ્રષ્ટિએ જરૂરી એવું 'ના વાંધા પ્રમાણપત્ર' સીવીલ એવીએશન ખાતા પાસેથી મેળવવાનું રહેશે અને સીવીલ એવીએશન ખાતાના નિયમોનું પાલન કરવાનું રહેશે.
- ભારતીય વાયુસેનાના હવાઈ મથક તથા ઈન્સ્ટોલેશનથી બાંધકામ કરવાની મર્યાદા ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય ધ્વારા જાહેરનામાથી વખતોવખત બહાર પાડવામાં આવે તેટલી વિજયા બહાર બાંધકામ કરવાનું રહેશે.
- (૧૨) ઓ.એન.જી.સી.ના કુવા નજીકમાં આવેલ જમીનના કિસ્સામાં અરજદારે સંબંધિત નિયમોનું પાલન કરવાનું રહેશે.
- (૧૩) નર્મદા કેનાલ/અન્ય સિંચાઈ કેનાલની નજીકમાં આવેલ જમીનની બાબતમાં અરજદારે સુચિત બાંધકામ માટે જાળવવાના થતાં અંતર અંગેના નિયમોનું પાલન કરવાનું રહેશે.
- (૧૪) અરજદારે/જ્યાં જરૂરી હોય ત્યાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના કાયદા નીચે રક્ષિત સ્મારક (PROTECTED MONUMENTS) તરીકે જાહેર કરેલ પ્રાચીન સ્મારકથી ૧૦૦ મીટર સુધીનું અંતર જાળવવાની પ્રવર્તમાન જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.
- (૧૫) અરજદારે/જ્યાં જરૂરી હોય ત્યાં ભારતીય વન અધિનિયમ હેઠળ અનામત વન જમીન કે રક્ષિત વન તરીકે જાહેર કરેલ વનજમીનથી જાળવવાના થતાં અંતર બાબતની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.
- (૧૬) અરજદારે/જ્યાં જરૂરી હોય ત્યાં વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ અન્વયે અભ્યારણ અથવા રાષ્ટ્રીય ઉપવન તરીકે જાહેર કરેલ કોઈપણ વિસ્તારની હદથી જાળવવાના થતાં અંતર બાબતની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.
- અરજદારે ઉપરોક્ત સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો તેમાં નિષ્ફળ જશે તો, શરતભંગ ગણી સહમત અધિકારી કાયદેસરની કાર્યવાહી કરશે.
- વધુમાં અરજદારશ્રીએ નીચેની શરતોનું પણ પાલન કરવાનું રહેશે.

- ૧૭) બાંધકામ શરૂ કર્યા તારીખથી એક માસમાં અને બાંધકામ પુરું કર્યા તારીખથી એક માસમાં એમ બન્ને પ્રસંગોએ અને લેખિતમાં જાણ કરવી પડશે.
- ૧૮) આ જમીન ઉપરનું મંજૂર થયા પ્રમાણે બાંધકામ આ હુકમ થયા તારીખથી છ માસમાં શરૂ કરી ત્રણ વર્ષમાં પુરું કરવાનું રહેશે. તેમ કરવામાં સુક થયે કલમ-૬૭ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને વસુલ ભરેલો વિ.ધારો વિગેરે કોઈપણ સંજોગોમાં પરત મેળવવાનો હકક રહેશે નહિ. આ અંગે અપીલનો સમય પૂરા થયા બાદ કોઈ હકક રહેશે નહિ.
- (૧૯) રજાચિટ્ટી, લેઆઉટ પ્લાન વિરુદ્ધ બાંધકામ થયાનાં પ્રસંગે કલેક્ટરશ્રી હુકમ કરે તે સમયમાં દુર કરવાનું રહેશે. અને તે વિરુદ્ધ વર્તન થયાનાં પ્રસંગે કબજેદારને ખર્ચે બાંધકામ દુર કરાવવામાં આવશે અને ખર્ચ જમીન મહેસુલ બાકી રાહ વસુલ કરવાપાત્ર થશે. કલેક્ટરશ્રી ઠરાવે તે દહ ભરવો પડશે.
- (૨૦) હુકમ થયા તારીખથી છ માસની અંદર કબજેદારે જમીન મહેસુલ કાપદામાં જણાવ્યા મુજબ નમુના "એમ" માં સનદ ભરી આપવાની રહેશે. તે વિરુદ્ધ વર્તન થયાનાં પ્રસંગે કલેક્ટરશ્રી ઠરાવે તે દહ ભરવાનો રહેશે. ઉકાર સનદ અપીલનો સમય પુરો થયા બાદ ભરી આપવાની રહેશે.
- (૨૧) જે હેતુનું બાંધકામ પુરું થયેથી એક માસની અંદર તેની જાણ પરવાનગી આપનાર અધિકારીને કબજેદારે કરવાની રહેશે.
- (૨૨) આ જમીનની જે હેતુ માટે પરવાનગી આપી છે તે હેતુ સિવાય અન્ય હેતુ માટે ઉપયોગ કરતાં પહેલાં કલેક્ટરશ્રીની પરવાનગી લેવાની રહેશે. તે વિરુદ્ધ વર્તન થયાના પ્રસંગે લે. રે. કોડની કલમ-૬૭ મુજબ પગલાં લેવામાં આવશે.
- (૨૩) "વરસાદી પાણીના ભૂગર્ભ વહન/સંચય માટે દર મકાન/ભુમણી મકાન (નકશા મંજૂર કરવાની સત્તા ધરાવતા સત્તાતંત્રને આપેલ મંજૂરી મુજબ) ટીક એકના દરે પરકોલેટીંગ બોરની વ્યવસ્થા અનુકરવાની રહેશે."
- (૨૪) જમીન ધારકશ્રીએ સક્ષમ સત્તાધિકારીશ્રી તરફથી મંજૂર થયેલ સુચિત નકશા અને રજાચિટ્ટી મુજબ બાંધકામ કરવાનું રહેશે. તેમજ રજાચિટ્ટી / વિકાસ પરવાનગીમાં જણાવેલ શરતોનું પાલન કરવાનું રહેશે તેમજ મંજૂર થયેલ રજાચિટ્ટી તથા નકશાની નકલ દિન-૩૦ માં રજૂ કરવાની રહેશે.
- (૨૫) બાંધકામ પરવાનગી સંબંધી લે-આઉટ પ્લાન મંજૂર કરાવતી વખતે વુડાએ કરેલા જી.વી.સી.આરના નિયમોનું પાલન કરવાનું રહેશે.
- (૨૬) વુડાના જી.વી.સી.આરના ઝોનીંગ રેગ્યુલેશન મુજબ બાંધકામની પરવાનગી મેળવ્યા બાદ જ અરજદારે બાંધકામ શરૂ કરવાનું રહેશે.
- (૨૭) આ જમીનનો વિશેષધારો, લોકલ ફંડ તથા શિક્ષણ ઉપકર પ્રવર્તમાન દરે હુકમની તારીખના મહેસુલી વર્ષથી આ સાથે સામેલ પત્રક મુજબનો ભરવાનો રહેશે.
- (૨૮) સવાલવાળી જમીન અંગે અરજદારશ્રીએ રજૂ કરેલ સુચિત લે-આઉટ પ્લાનમાં દર્શાવ્યા પ્રમાણે રસ્તા પૈકીની જમીન, કોમન પ્લોટની જમીન અને સહીધારા ઉપયોગ માટે ખુલ્લી રાખેલ જમીનનું કોઈપણ રીતે વેચાણ થઈ શકશે નહીં.
- (૨૯) ઉપરની કોઈપણ શરત અંગર સનદમાં જણાવેલી શરતો પૈકી કોઈપણ શરતનો ભંગ થયા પ્રસંગે જમીન મહેસુલ કાપદામાં જણાવેલી શિક્ષાને કબજેદાર પાત્ર અને તેનો બાધ લીધા સિવાય કલેક્ટરશ્રી જે પગલાં લેશે તે કબજેદારને બંધનકર્તા રહેશે.

રવાના કર્યું
મામલદારશ્રી (બિનખેતી)
કલેક્ટર કચેરી, વડોદરા



સહી/-
(લોચન સેઠરા)
કલેક્ટર વડોદરા

પ્રતિ,

- (૧) શ્રી મોરે ભરતભાઈ કુખડકર્તા
(૩) શ્રી ભટ્ટ વિલાસભેન ચૈતન્યકુમાર
(૫) શ્રી ભટ્ટ અલપાભેન ગૌરાંગભાઈ
(૭) શ્રી ભટ્ટ શાંતિલાલ ત્રિભોવનદાસ
(૮) શ્રી ભટ્ટ ઈન્દુમતીબેન નરહરીભાઈ

- (૨) શ્રી ભટ્ટ ગૌરાંગભાઈ શાંતિલાલ
(૪) શ્રી શુકલ ગીરીશકુમાર ધનસ્થામભાઈ
(૬) શ્રી ભટ્ટ જયોતિબેન શાંતિલાલ
(૮) શ્રી ભટ્ટ ચૈતન્યકુમાર શાંતિલાલ

રહે. ૪, સનત પાર્ક, ન્યુ સમા રોડ, તા. જી. વડોદરા.

નકલ રવાના :-

૧. મામલતદારશ્રી, વડોદરા શહેર (દક્ષિણ) તરફ હુકમની શરતોનો નોંધ તથા નોંધ, ૭/૧૨ ની નકલ સહ જાણ કરવા સાડ.

TRUE COPY
LALIT R. SHAH B.E. (CIVIL)
V.M.C. IN CHARGE, ER 103/2015 To 2046
P.O. ARCHITECTS
Vadodra, Ph. 9958003000

વડોદરા

- મ્યુનિસિપલ કમિશનરશ્રી, વડોદરા મહાનગર સેવાસંઘન, ખંઠેરાવ માર્કેટ, વડોદરા તરફ જાણ
સારું.
૩. જિલ્લા નિરીક્ષકશ્રી, જમીન દફતર / સીટી સર્વે સુપ્રીટેન્ડન્ટશ્રી નં. ૧, ૨, ૩, ૪ વડોદરા તરફ...
 ૪. તલાટી કમ મંત્રીશ્રી માંજલપુર, તા. વડોદરા તરફ હુકમ મુજબ અમલવારી કરવા સારું
 ૫. જન સેવા કેન્દ્ર, કલેક્ટર ક્લેરી, વડોદરા તરફ જરૂરી કાર્યવાહી કરવા સારું.
(BAR CODE NO. 54070)
 ૬. રેકર્ડ શાખા
 ૭. સિલેક્ટ ફાઈલ

મોજે માંજલપુર તા.જી. વડોદરાના સ.નં. ૩૩૬૪, ટી.પી.નં. ૧૯, ફા.પ્લોટ નં. ૪૩૮ ની ૧૪૩૪ ચો.મી. જમીનની બીનપેલીની પરવાનગી અનુસાર વસુલ કરવામાં આવેલ છે.

બીનપેલીની પરવાનગી માંગેલ જમીનનો સ.નં.,
ક્ષેત્રફળ તથા કબજેદારનું નામ

૧		૨	૩	૪	૫	૬	૭	૮
મોજે માંજલપુર તા. વડોદરા		ચો.મી. ૧૪૩૪ (રહેણાંક)	૬૨ ચો.મી. ના ૦.૨૫ પૈસા પ્રમાણે	રો. ૩૫૯/- (અંકે રૂપિયા ત્રણસો આઠાણ ચાલક પુરા)	રો. પૈસા ૧૪,૩૪૦/- (અંકે રૂપિયા ચૌદ હજાર ત્રણસો ચાલીસ પુરા)	રો. પૈસા ૧૮૦/- (અંકે રૂપિયા એકસો એસી પુરા)	રો. પૈસા ૬૦/- (અંકે રૂપિયા ત્રણ પુરા)	કોલમ-૪ નો વિ.ધારી કઈ તારીખથી લેવાનો છે તેની વિગત
સર્વે નંબર	ટી.પી. નંબર	ફા.પ્લોટ નંબર	ક્ષેત્રફળ (ચો.મી.)	વસુલ કરવાની વિશેષ ધારાની રકમ (૦.૨૫ પૈસા પ્રતિ ચો.મી.)	રૂપાંતરકર લેવાની વિગત (૧૦/- પ્રતિ ચો.મી.)	લોઅર કંડની વિગત (૦.૫૦ પૈ. વિ.ધારાના)	વિવરણ ઉપકરની રકમ (૦.૨૫ પૈ. વિ.ધારાના)	કોલમ-૪ નો વિ.ધારી કઈ તારીખથી લેવાનો છે તેની વિગત
૩૩૬૪	૧૯	૪૩૮	૧૪૩૪					

કબજેદાર શ્રી :-

- (૧) શ્રી બોડે ભરતભાઈ કૃષ્ણકાંત
- (૨) શ્રી ભટ્ટ ગોવિંદભાઈ શાંતિલાલ
- (૩) શ્રી ભટ્ટ વિલાસભેન ચૈતન્યકુમાર
- (૪) શ્રી ચુડલ ગીરીશકુમાર ધનશ્યામભાઈ
- (૫) શ્રી ભટ્ટ અલ્પાભેન ગૌરાંગભાઈ
- (૬) શ્રી ભટ્ટ જ્યોતિભેન શાંતિલાલ
- (૭) શ્રી ભટ્ટ શાંતિલાલ ત્રિભોવનદાસ
- (૮) શ્રી ભટ્ટ ચૈતન્યકુમાર શાંતિલાલ
- (૯) શ્રી ભટ્ટ ઇન્દુભાઈ નરહરીભાઈ

નોંધ:- રૂપાંતરકરની રકમ રો. ૧૪,૩૪૦/- (અંકે રૂપિયા ચૌદ હજાર ત્રણસો ચાલીસ પુરા) તા. ૦૨/૦૮/૨૦૧૬ ના રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં "૦૦૩૫" સહ રકમ કરાવી અસલ ચલન રજુ કરેલ છે.

રવાના કર્યું

મામલમજી બીનપેલી
ક્લેક્ટર કચેરી, વડોદરા



TRUE COPY

Shah

LALIT R. SHAH B.E. (CIVIL)

V.H.C. Lic No. ER/108/2013

POOJA ARCHITECTS

5-9 Blue Diamond Complex, F-9/1

Surat, Gujarat, India. 392002

સહી-
(લેખન સહયોગી)
ક્લેક્ટર વડોદરા